## JYOT INTERNATIONAL MARKETING LIMITED

Registered Office: 1, 1, Pandurang Society, Opposite WIAA Institute, Judges Bunglow Road,
Bodakdev, Ahmedabad. Gujarat – 380 054 Email: jyotimltd@gmail.com,
CIN: L65910GJ1989PLC012064, Mo.9099946908, Web. www.jyotinternationalmarketing.co.in

DATE: 06/06/2024

To,
The Department of Corporate Services BSE Limited
Ground Floor, P.J. Tower Dalal Street,
Mumbai- 400001

SCRIP CODE: 542544

Dear Sir/Madam,

Sub: Newspaper Advertisement on Publication of Audited Financial Results dated May 30,2024

Pursuant to Regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copy of the newspaper clippings for the advertisement published in Business Standard in English Language and jai Hind in Gujarati language on June 06,2024 for advertisement matter regarding Extract of Audited Financial results for the Quarter and Year ended on 31 March, 2024.

Kindly take the same on your record.

Thanking You,

Yours faithfully,

For, Jyot international Marketing Limited

DINI- 03-48068

NIRBHAY COLOURS INDIA LIMITED (Formerly known as "Parth Industries Limited")
CIN: L91110GJ1993PLC017863
Regd. Off: No # 61/201, 2nd floor, Prerak Apartment, Near Wagh Bakri Tea Depot, Gujarat College Road, Ahmedabad - 380 006

Statement of Audited Results for the Quarter and Year Ended 31-03-2024 (Rs. In Lac 
 Quarter Ended
 Year Ended

 31.03.2024
 31.12.2023
 31.03.2023
 31.03.2024
 31.03.2023
 Total Income from Operation Total Income from Operation
NetProfit (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)
NetProfit (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)
NetProfit (Lloss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)
NetProfit (Lloss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax)
and Other Comprehensive Income (after tax) 0.92 164.44 4.38 0.92 164.44 4.38 5.76 5.76 (0.73) (0.73) 121.80 121.80 2.73 2.73 120.20 335.00 335.00 335.00 335.00 -110.84 **Equity Share Capital** Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the Earning Per Share (Face Value of ₹ 10/- each) (for continuing and discontinued operations)-0.17 3.59 (0.02)3.64 0.08

The above is an extract of the detailed format of QuarterlylAnnual Financial Results filed on a standalone basis filed with the Stock Exchanges under Regulation 33 of the SEB (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterlyl Annual Financial Results are available on the websites i.e. wavewbase india.com and also on the company website. www.habhayeolours.com By Order of the Board of Director

The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors.

Raghvendra Kulkarni (Managing Director) - DIN: 06970323 Place: Ahmedabad Date: 27.05.2024

PUBLIC FU/I/3 ENVINONMENTAL LEARNING.
It is here by informed that Ministry of Environment, Forest and Climate Chang (MOEF&CC)-Impact Assessment Division has accorded the Environmenta Clearance for expansion of manufacturing plant of Synthetic Organic Hoemicals By Miss. SUMAN CHEMICAL INIDUSTRIES Located at Shed No. C-1-8-461, Road No. 824, GIDC Sachin, Tal.: Chorasi, Dist.: Surat, Cuijara vide Letter. No. IAJ-110114772022-AHI(I) dated 04/07/2023 under the provision of EIA Notification dated 14th September 2006.

Copy of the Environmental Clearance letter is available with GPCB and o wheshle https://parivesh.nic.in/ Committee and also be seen at website of the CPCB.

na gasosos gas 🙉 trous GSAD, Circle Office Surat : 4th Floor, Tulsi Krupa Arcade, Parvat Patiya, Surat-395010

General Public is informed that the undersigned had published Advertisement Dated **23-05-2024** for date to submit duly filled BID is extend to 13-06-2024 till 18.00 hrs. All oth

### ANANDRATHI

### **ANAND RATHI WEALTH LIMITED**

Corporate Identity Number (CIN): L67 120MH 1965PL C086996
Registered Office: Floor No. 10, A Wing, Express Zone, Western Express Highway,
Goregaon (E), Mumbai - 400 063; Tel. No.: +91-22-6281 7000.
porate Office: Floor No. 2 & 3, Block B, C. E. Wing, Trade Link, Kamala Mills Compo
Senapati Bapat Marg, Lower Pack Mumbai - 400 013; Tel. No.: +91-22-6981540001
Email ID: csarws@crathi.com | Website: www.anandrathiwealth.in
Contact Person: Ms. Jaee Sarwankar-Company Secretary & Compliance Officer

### NOTICE TO ELIGIBLE SHAREHOLDERS-BUYBACK OF EQUITY SHARES

Anand Rathi Wealth Limited ("Company" / 'ARWL') has sent the Letter of Offer and Form of Acceptance-cum-Acknowledgement (the "Tender Form") along with the share transfer form ("Form SH-4") dated June 04, 2024 for Buyback through electronic means to all the Eligible Shareholders holding Equity Shares so n the Record Date (Monday, June 03, 2024), who have registered their e-mail ids with the Company or Depositories.

Further: if the Company or Depositions:

Further: if the Company or the Registrar receives a request, along with details as specified under paragraph 22.25 of the Letter of Offer, from any Eligible Shareholders for physical copy of the Letter of Offer/Tender Form, the same shall be provided to such Eligible Shareholder.

The Schedule of activities for the Buyback is as follows

Activity	Day and Date				
Buyback Opening Date	Friday, June 07, 2024				
Buyback Closing Date	Thursday, June13, 2024				
Last date and time for receipt of completed tender form and other documents by the Registrar to the Buyback	Thursday, June 13, 2024, 5:00 P.M. (IST)				

For detailed activity of schedule please refer to the Letter of Offer

The detail of Buyback Entitlement in each category are as follows

Category of Eligible Shareholders	Ratio of Buyback (i.e. Buyback Entitlement)*					
Reserved category for Small Shareholders	37 Equity Shares for every 483 Equity Shares held as on the Record Date					
General category for all other Eligible Shareholders	3 Equity Shares for every 392 Equity Shares					

For further information on Ratio of Buyback as per the Buyback Entitlement in each Category, please refer Paragraph 2.1.6 on page 40 of the Letter of Offer. Elligible Shareholders can also check their entitlement on the website of the Registrar to the Buyback by following the steps given below:

Click on <u>www.linkintime.co.in</u>;

- Select the name of the Company "Anand Rathi Wealth Limited".
   Select holding type "Physical" or "NSDL" or "CDSL"
- 4) Based on the option selected above, enter your "Folio Number" or "NSDL DPID/Client ID" or "CDSL Client ID
- 5) Click on Submit

6) The entitlement will be provided in the pre-filled "FORM OF ACCEPTANCE-CUM ACKNOWLEDGEMENT The Letter of Offer and Tender Form are also available on the website of the Company at https://www.anandrathiwaelth.ni/investor-relations.php. the Registrar to the Buyback at <a href="www.linkintime.co.in">www.linkintime.co.in</a>. the Stock Exchanges at <a href="https://www.nseindia.com">www.nseindia.com</a>. SEBI at <a href="https://www.sebi.gov.in</a> and the Manager to the Buyback at <a href="https://www.mark.comportaleadvisors.com">www.sebi.gov.in</a> and the Manager to the Buyback at <a href="https://www.mark.comportaleadvisors.com">www.sebi.gov.in</a> and the Manager to the Buyback at <a href="https://www.mark.comportaleadvisors.com">www.sebi.gov.in</a> and the Manager to the Buyback at <a href="https://www.mark.comportaleadvisors.com">www.sebi.gov.in</a> and the Manager to the Buyback at <a href="https://www.mark.comportaleadvisors.com">www.sebi.gov.in</a> and the Manager to the Buyback at <a href="https://www.mark.comportaleadvisors.com">www.sebi.gov.in</a> and the Manager to the Buyback at <a href="https://www.mark.comportaleadvisors.com">www.sebi.gov.in</a> and the Manager to the Buyback at <a href="https://www.mark.comportaleadvisors.com">www.sebi.gov.in</a> and the Manager to the Buyback at <a href="https://www.mark.comportaleadvisors.com">www.sebi.gov.in</a> and the Manager to the Buyback at <a href="https://www.mark.com/

For Anand Rathi Wealth Limited

Place : Mumbai Date : June 05, 2024 Jaee Sarwankar
Company Secretary & Compliance officer PUBLIC NOTICE That, our



### Tamilnad Mercantile Bank Limited Ringroad Branch:

Ringroad Branch : Plot No.25/C, 25/D,8 25/E Ground Floor, Animesh House, Kinnary Cine Ringroad Branch, Surat - 395002, Gujarat Email:-surat\_ringroad@tmbank.in, Phone No.0261- 2366500, 2367600

Auction Notice for Sale of Immovable Properties

Auction Sale Notice for Sale of Immovable Assets mortgaged / charged to the Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002

Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(§) and 9(1) of the Security Interest Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described Movable immovable properties mortgaged/charged /hypothecated to the Secured Credit, the Physical Possession of which has been taken by the Authorized Officer of Tamilinad Mercantile Bank Limited, Ringroad Branch, will be sold "As is where is", "As is what is", and "Whatever there is" on 25.06.2024 for recovery of Rs. 1,22,40,556.44 (Rupees One Crore Twenty Two Lakh Forty Thousand Five Hundred Fifty Six and Paise Forty four Only) (Cash Credit for Rs.91,84,534.65 and Term Loan-GECL for Rs. 23,74,556.98 and Expenses for Rs. 518,665.90 as on 31.03.2024) due to the Tamiliand Mercantille Bank Limited, Ringroad Branch with subsequent interest and expenses from the Borrower(s) Mis.Daksh Creation, Proprietor: Mr. Patel Daxes-Meximum Babubhai, Sio. Babubhai Parbatbhai Patel and Guarantor(s) Mr.Patel Alpesh Manubhai, Sio. Mr. Manubhai Kalyanbhai Patel
The reserve price will be Rs. 2,50,0000-01.

The reserve price will be Rs. 25,00,000/- and the earnest money deposit will be Rs. 2,50,000/-						
Place of Auction	Tamilnad Mercantile Bank Ltd., Plot No.25/C, 25/D,& 25/E Ground Floor, Animesh house, Kinnary Cinemas, Ringroad Branch, Surat - 395002, Gujarat, email:-surat_ringroad@tmbank.in, Phone No.0261-2366500. 2367600					
Date and Time of Auction Sale	25.06.2024 at 11.00 A.M					

Date and Lime of Auction Sale | 25.06.2U24 at 11.00.40 Property:

All that piece and parcel of land bearing Plot No.131 as per old plan and as per revised plan Plot No.175 (at sight Known as Plot No.137) admeasuring 112.88 Sq. Mr together with Residential building constructed thereat to the extent of 174.00 Sq.mt, together with undivided proportionate share in road and COP admeasuring 45.47 sq.mtr and 22.10 sq.mt respectively, total admeasuring 180.45 sq.mtrs situated at "Harshsraj Heaven" Row House, on the land bearing New Block No.3521 its Rev.S. No.517 pakes No.517 pakes No.517 pakes No.517 pakes No.517 pakes Standing in the name of Mr.Alpach Manubhai Palet. Boundaries: North By: Plot No.138, South By: Plot No.136. East By: By Society Road, West By: By Plot No.123

For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured creditor

Authorised Officer Tamilnad Mercantile Bank Ltd Ahmedabad Regional Office For Surat Ringroad Branch

MADHUVEER COM 18 NETWORK LIMITED Regd. Off: No # 812, Anand Mangal - III, Opp. Core House, Ambawadi, Ahmedabad - 380 006. Email : tohealpharmachem@gmail.com Statement of Audited Standalone Results for the Quarter and Year Ended March 31, 2024 (Rs. In Lacs) Particulars Quarter Ended 31.03.2024 31.03.2024 31.03.2024 31.12.2023 3 Total Income from Operation

NetProfit / Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)

NetProfit / Loss) for the period before Tax (after Exceptional and or Extraordinary items)

NetProfit / Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)

Total Comprehensive Income for the period (Ecompring Profit/(Loss) for the period (after tax)
and Other Comprehensive Income (after tax)|

Equity Share Capital

Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.

Earning Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations)
Basic

Diluted 13.32 1.35 1.35 1.01 1.01 14.9 1.5 1.5 1.12 1.12 423.36 403.74 671.26 314.15 692.09 296.08 2.39 2.38 2.38 0.06 0.01 0.01 -0.91 -0.72 -0.72 296.08 233.69 233.69 275.35 275.35

Place: Surat Date: 04.06.2024

Notes: a. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed on a standalone basis filed with the Stock Exchanges under Regula of the Quarterly/Annual Financial Results are available on the websites i.e. www.bss.india.com and also on the company website: www.mcom18.com

b. The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors.

Place : Ahmedabad Date : 28.05.2024

By Order of the Board of Directors Sd/-For, MADHUVEER COM 18 NETWORK LIMITED Divya Rathi - Company Secretary - PAN: CCPPR7114F

IYOT INTERNATIONAL MARKETING LIMITED Registred Office: Room No # 1, 1, Pandurang Society, Judges Bungalow Road, Bodakdev, Ahmedabad. Gujarat - 380 054											
CII	CIN: L65910GJ1989PLC012064 Statement of Audited Standalone Results for the Quarter and Year Ended March 31, 2024 (Rs. In Lacs)										
Sr	Particulars	Standalone Ouarter Ended			Year Ended		Consolidated Ouarter Ended			Year Ended	
No	Particulars	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023	31.03.2024	31.12.2023	31.03.2023		31.03.2023
1	Total Income from Operation	147.69	117.83	114.43	497.3	405.81	148.52	117.87	114.43	500.25	1827.72
2	NetProfit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	16.88	1.78	10.28	33.55	12.07	-142.86	0.82	-2.56	126.56	1407.45
3	NetProfit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	16.88	1.78	10.28	33.5	12.07	-142.86	0.82	-2.56	126.56	1407.45
4	NetProfit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	12.65	1.33	7.83	25.13	8.92	-147.09	0.37	-4.82	-148.82	1266.07
5	Total Comprehensive Income for the period (Compriing Profit/(Loss) for the period (after tax)	12.65	1.33	7.83	25.13	8.92	-147.09	0.37	-4.82	-148.82	1266.07
	and Other Comprehensive Income (after tax)]										
6	Equity Share Capital	312.19	312.19	312.19	312.19	312.19	312.19	312.19	312.19	312.19	312.19
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.	104.33	103	79.19	79.19	79.19	2288.45	228.08	2437.27	2288.45	2437.27
8	Earning Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations)-										
	Basic	0.41	0.04	0.25	0.25	0.29	-4.71	0.01	-0.15	-4.77	40.55
	Diluted	0.41	0.04	0.25	0.25	0.29	-4.71	0.01	-0.15	-4.77	40.55

Notes: a. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filled on a standalone basis filled with the Stock Exchanges under Regulation 33 of the SEBI Listing and Other Disc of the Quarterly/Annual Financial Results are available on the velocities in. www.bss.india.com and also on the company website: www.lyotinternationalmarketing.co.in
b. The above results were reviewedly the Audit Committee and threather approved by the Board Committee an

....

Place : Ahmedabad Date : 30.05.2024 0000

By Order of the Board of Directors Sd/-For, JYOT INTERNATIONAL MARKETING LIMITED Jayesh Narendrakumar Shah - Managing Director - DIN: 03548968

# **Insight Out**

Companies,

Companies, Monday to Saturday

To book your copy, sms reachbs to 57575 or email order@bsmail.in



# સરકાર રચના પૂર્વે જ ભાજપ દબાણમાંઃ સાથી પક્ષોની મસમોટી ડીમાંડ

લોકસભાની ચૂંટણીમાં ભાજપ કે કોઇ એક પક્ષનું સંપૂર્ણ બહુમતી મળી શકી નથી અને એનડીએની મોરચા સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે એનડીએના ભાજપ પછીના સૌથી મોટા પક્ષ એવા ટીડીપી દ્વારા મહત્વના પાંચ પદ માંગવામાં આવ્યા હોવાનું ચર્ચાથી રાજકારણમાં હલચલ મચી છે. એટલું જ નહીં જેડીયુ દ્વારા પણ મોટી ડીમાંડ કરવામાં આવે તેવી

ચર્ચા થઇ રહી છે. એનડીએ સરકારના ગઠન માટે ટીડીપી તથા જેડીયુનું સમર્થન નિર્ણાયક છે. બંનેની કુલ ૨૮ બેઠક છે અને તેના આધારે જ એનડીએ બહમતીનો આંકડો પાર કરી શક્યું છે. નવી સરકાર બનાવવાની તૈયારીના ભાગરૂપે બપોરે ૪ વાગ્યે એનડીએની બેઠક યોજાવાની છે અને તેમાં ટીડીપી દ્વારા પાંચ મહત્વના

ભારતના મુખ્ય ન્યાયાધીશ

ઓક્સફર્ડ યુનિયન

ડી.વાય. ચંદ્રસુડ (ડીવાય ચંદ્રસુડ)

સોસાયટીમાં લોકોને સંબોધિત

કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું

લો કશાહીનો

મૂળ આધાર છે,

ભારતમાં

ન્યાયાધીશોની

પસંદગી થતી

પાછળનું એક

ન્યાયાધીશો

સંજારેગાેની

સાતત્ય, બંધારણીય મૂલ્યોની

સાતત્યની ભાવનાને પ્રતિબિંબિત

કરે છે.ડી.વાય. ચંદ્રચુડે કહ્યું,

'અમે સરકારના રાજકીય પક્ષથી

પ્રમાણમાં અલગ જીવન જીવીએ

છીએ, પરંતુ દેખીતી રીતે

ન્યાયાધીશોએ તેમના નિર્ણયોની

રાજકારણ પરની અસર વિશે

જાગૃત હોવું જોઈએ. આ રાજકીય

દબાણ નથી, પરંતુ કોર્ટના

કો ઈપણ નિર્ણયની સંભવિત

અસરની સમજ છે.સમલૈંગિક

લગ્ન પર બોલતા, મુખ્ય

ચુકાદાનો બચાવ નથી કરી રહ્યો,

કારણ કે એક ન્યાયાધીશ તરીકે,

હું માનું છું કે એકવાર ચુકાદો

સંભળાવવામાં આવે છે, તે માત્ર

દેશની જ નહીં પરંતુ વૈશ્વિક

સમદાયની સંપત્તિ બની જાય છે

ન્યાયાષાશ કહ્યું,

નવી દિલ્હી, તા.૫ પદની માંગણી રજ કરવામાં આવે લોકસભાના સ્પીકર પદ માટે તો તે તેવી શક્યતા છે અને તેને પગલે ભાજપ દબાણમાં આવી શકે છે.

સુત્રોએ એમ જણાવ્યું છે કે ટીડીપીના નેતા ચંદ્રાબાબુ નાયડુ

### નીતિશકુમારે પણ પક્ષના સાથીદારો સાથે ચર્ચા કરીને મહત્વના ખાતાની માંગ મૂકવાની તૈયારી કર્યાનો નિર્દેશ

એનડીએની બેઠકમાં પાંચ મહત્વના પદ માટે ડીમાન્ડ રજુ કરી શકે છે. તેઓ દ્વારા નાણાં, શિક્ષણ જેવા મહત્વના મંત્રાલય ઉપરાંત લોકસભાના અધ્યક્ષ પદની પણ માંગણી થઇ શકે છે. આ સિવાય માર્ગ-પરિવહન મંત્રાલય, ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ, આરોગ્ય, કૃષિ જેવા મંત્રાલયોમાંથી પાંચ ખાતા આવી છે. માંગવામાં આવે તેવી સંભાવના છે.

CJI ચંદ્રચુડે ઓક્સફર્ડ યુનિયન સોસાયટીમાં કહ્યું

રાજનીતિ પર અસર વિશે જાણવું જોઇએ'

સંસદ દ્વારા ધડવામાં આવેલ

કાયદો હતો. જે વિજાતીય

સંબંધોમાં લગ્નની કલ્પના કરે

છે.ચંદ્રચુડે કહ્યું કે મારા ત્રણ

સાથીદારો અમારી સાથે સહમત

ઘર અને હૃદય સુધી લઈ જવાની

જરૂર છે.ડી.વાય. ટેકોલોજી અને

છેં પર બોલતા, ચંદ્રચુડે કહ્યું કે તે

મહત્વપૂર્ણ છે કે આપણે ન્યાયની

માનવીય ડિલિવરી સુનિશ્ચિત

કરવા માટે ટેક્રોલોજીનો ઉપયોગ

કરવાના ફાયદા અને

ગેરફાયદાને સમજીએ અને તેને

સમલેં ગિક

લગ્નને માન્યતા

આપવી એ પણ

કાે ટેના

અધિકારક્ષેત્રની

વહીવટની

'ન્યાયાધીશોએ તેમના

કે ચૂંટણી એ બંધારણીય ન હતા. તેમને લાગ્યું કે

ભારતના મુખ્ય

ન્યાયાધીશ ડી.વાય.

ચંદ્રચુડ (ડીવાય

નથી. તેની ચંદ્રચુડ) એ ઓક્સફર્ડ બહાર છે.

કારણ એ છે કે યુનિયન સોસાયટીમાં અને કાયદાના

લોકોને સંબોધિત કર્યા પ્રક્રિયાને લોકોના

મહત્વ આપીએ.

કુત્રિમ બુદ્ધિ

અમર્યા દિત

ખુદ્ધી ડીમાંડ મુકવાના હોવાનું કહેવાય

ચંદ્રાબાબુ નાયડુ ઉપરાંત એનડીએના ત્રીજા નંબરના સૌથી મોટા પક્ષ એવા જેડીયુના નીતિશકુમાર દ્વારા પણ મોટી ડીમાંડ રજુ કરવામાં આવનાર છે. તેઓ દ્વારા પણ સંરક્ષણ જેવા મોટા અને મહત્વના ખાતાની ડીમાંડ કરવામાં આવે એવી શક્યતા છે.

એનડીએની નવી સરકારની રચના પૂર્વે જ ભાજપ માટે મોટા આંતરિક પડકાર સર્જાવાના હોય તેમ પાંચ બેઠક જીતનાર લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન દ્રારા બે મંત્રાલયો માંગવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ જ રીતે બિહારમાં એક માત્ર ચૂંટાયેલા માંજી દ્વારા પણ પ્રધાનપદની ડિમાંડ આગળ ધરવામાં

છીએ અને સંચારની પ્રક્રિયાને

ન્યાયાધીશોથી રોબોટમાં ન

બદલીએ.મુખ્ય ન્યાયાધીશ

ડી.વાય. ચંદ્રસુડે કહ્યું, 'હું માનું

છું કે આધુનિક લોકશાહીમાં

સમાજે અન્ય રીતે ઘણું કરવાનું

હોય છે. તમે સમાજમાં

ઉદભવતા દરેક મુદ્દા કે વિવાદને

ઉકેલવા માટે કોર્ટ તરફ જોઈ

શકતા નથી.તેમણે વધુમાં કહ્યું કે

ન્યાયાધીશ તરીકે આપણે એક

લાઇન નક્કી કરીએ અને નક્કી

કરીએ કે આપણા અધિકારક્ષેત્રમાં

કાયદેસર શું છે અને નાગરિક

સ માજ સહિત મે મારૂ જુનું નામ ધોળકિયા

સ મા જ ના મીના મહેશચંદ્ર થી બદલીને નવું

ભાગો ની રાખેલ છે. સરનામું : એ-૬૦૪,

કાયદેસરની શ્યામ રેસીકેન્સી, વુજધામ

નામ ધોળકિયા મીના મહેશ

હવેલીની સામે, સીમા હોલની

પાછળ, આનંદનગર મેઇન

રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫.



વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં બુધ્ધ જયંતિ પાર્ક ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વુક્ષારોપણ કરી રહ્યા છે.

## સખત ગરમી, રૂપિયો નબળો પડયો, તાંબા અને એલ્યમિનિયમમાં ભાવવધારો

આ મહિનાથી લોકોએ રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઈકોવેવ ઓવન, પંખા, રસોડાનાં ઉપકરણો, ખુરશીઓ અને પંપ જેવી ઈલેક્ટ્રીકલ વસ્તુઓ ખરીદવા માટે ૨.૫ ટકા વધુ ચુકવવા પડશે. ઉદ્યોગના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સેમસંગ ઈલેક્ટ્રોનિકસ ઈન્ડિયા, હેવેલ્સ, બજાજ ઈલેક્ટ્રીકલ્સ અને વી–ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ જેવા મોટા ઉત્પાદકોએ પહેલાથી જ કિંમતમાં વધારો કર્યો છે અથવા તેઓએ તેમના ડીલરોને કહ્યું છે કે તેઓ ટુંક સમયમાં કિંમતો વધારવાના છે. આ ભાવ લગભગ નવ મહિના પછી વધ્યા છે. રૂપિયો નબળો પડવા ઉપરાંત તાંબા અને એલ્યુમીનીયમ જેવી વસ્તુઓના ભાવમાં ૨૦-૨૫ ટકાનો વધારો. છેજ્ઞા બે-ચાર મહિનામાં લાલ સમુદ્રની કટોકટીને

કારણે નૂર ખર્ચમાં વધારો થયો છે. હોમ એપ્લાયન્સ ઉત્પાદક કંપની સેમસંગ ઈલેક્ટ્રોનીકસ ઈન્ડીયાએ તેના બિઝનેસ પાર્ટનર્સને વોટસએપ મેસેજ દ્વારા જાણ કરી કે ઈનપુટ કોસ્ટમાં વધારો થયો છે. તેથી, અમે જૂનથી હોમ એપ્લાયન્સ

સામાનના ભાવમાં ૨.૫% વધારો

કરીશું.

IN THE COURT OF HONORABLE JUDGE SHRI H.P. MEHTA SIR COURT NO. 06 **PUBLIC SUMMONS** IN THE COURT OF COMMERCIAL COURT AT CITY CIVIL COURT OF AHMEDABAD

COMMERCIAL CIVIL SUIT NO. 3843/2021

Plaintiff Advocate Shri: M.B. Suthan Plaintiff: Punjab National Bank, Having its head office at: 1970, having head office at: Plot No. 4, Sector-10, Dwarka, New Delhi - 110075 and inter alia branch office at Circle Sastra, 6th Floor, Ashram Road, Ahmedabad, Gujarat,

Defendant-1: Smt. Bhanvariben C. Rathod Defendant-2: Shankarsingh D. Sisodiva Defendant-3: Chandansingh D. Rathod

All are at Res.: A-1, Vaibhav Apartment, Jivraj Park, Vejalput, Ahmedabad-380051.

Suit Valued At Rs. 18,81,575.00

જાહેર થઈ ગયા છે. ૪૦૦ને પાર

કરવાનો ટાર્ગેટ ધરાવતી એનડીએ

આ ચૂંટણીમાં ૩૦૦ બેઠક સુધી

પણ નથી પહોચી શકી. ખાસ કરીને

ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો

ઝટકો લાગ્યો છે. એવામાં ઉત્તર

પરિષદના પ્રમુખ ગોવિંદ પરાશરે

દિલ્હી એરપોર્ટ પર ટોરંટોની કલાઇટમાં

બોમ્બની ધમકીથી હડકંપ મચ્યો

વિમાનમાં બોમ્બ હોવાનો ઈ-મેલ

આઈજીઆઈ વિમાન મથકને મળતા હડકેય મચી ગયો હતો. જો કે બાદમાં

તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી

નહોતી.દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ

લિમિટેડ (ડીઆઈએએલ) કાર્યાલયને

મંગળવારે રાત્રે ૧૦.૫૦ વાગ્યે એક ઈ-

મેલ મળ્યો હતો

અત્રે એર કેનેડાના ટોરંટો જતા

નવી દિલ્હી તા.૫

આગ્રામાં રહેતા રાષ્ટ્રીય હિંદ

પ્રદેશના

Whereas you the defendant is hereby informed that the summons issued against you by this court repeatedly remained unserved and as your whereabouts are unknown this summons is published as per order below Exh. 17.

Whereas the plaintiff above named has instituted suit against you under Ord XXXVII of the code of Civil Procedure, 1908 for Rs. 18,81,575.00 with interest and cost from the date of filling of the suit till realization. You are hereby summoned to cause and appearance to be entered for you within ten days from the publication hereof in default where of the plaintiff will be entitled to at any time after the expiration of such ten days to obtain decree for any sum not exceeding the sum of Rs. 18,81,575.00 and such amount as the court may award for costs and nterest. If any as the court may award. if you, cause and appearance to be entered for you, the plaintiff will thereafter

served upon you a summons for judgment at the hearing of which you will be entitled to ask the court for leave to defend the suit. Leave to defend may be obtained if you satisfy the court by affidavit or otherwise

t there is a defense to the suit on ment or that if reasonable

Given under my hand and the seal of the Court on 06th day of May, 2024. (C.M. Mahida) (R.M. Datania) Prepared by Compared By

Registrar, City Civil Cour Bhadra, Ahmedabad I/c. Superintendent

નવી દિલ્હી : : દેશમાં પોતાના ઘરમાં ટીવી તોડી નાખ્યું. વાયરલ થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીના પરિણામો

'૪૦૦ પાર' સફળ ન થતા હિન્દુ પરિષદના પ્રમુખ

### **PUBLIC NOTICE** TO WHOMSOEVER IT MAY CONCERN

This is to inform the General Public that following share certificate of BLUE DART EXPRESS LIMITED having its Registered Office at Blue Cart Centre, Airport Road, Andheri (W) Mumbal - 400099. registered in the name of the following older/s have been lost by the

tamilaben K. Patel R03596 98948 12268375 to 12268474 100 The Public are hereby cautioned against purchasing or dealing in any way with the

bove referred share certificates above referred share certificates.

Any person who has any claim in respect of the said share certificate/s should lodge such claim with the Company or its Registrar and Transfer Agents Link intime India Private Limited, 247 Park, C-101, L.B.S. Marg, Vikhroll (West), Mumbai - 400083 within 15 days of publication of this notice after which no claim will be entertained and the Company shall proceed to issue Duplicate Share Certificate/s.

Date: 19.04.2024 Place: Ahmedabad SD/- Ramillaben K. Pate

### **PUBLIC NOTICE**

PAGE NO ITEM NO. 12 Case No. SA/129/2024 13.5.2024 RADHABEN RAJESHBHAI THANKI

STATE BANK OF INDIA Mr. Dhruvin Dossani, Id. Proxy Counsel for Applicant.

Mr. C.Z. Sankhla, Ld. Counsel for Respondent ARC.

None present for Respondent no. 2. IA Ex.A/14 filed by Applicants is taken on record.

Heard and perused.

Application Ex.A/14 has been moved by Applicant for service of notice on Respondent no.2 through paper publication stating that the Applicant has sent notice on Respondent no.2 through registered post, but notice have not been served on Respondent no. 2 at Mumbai and Ahmedabad addresses returned as 'addressee absent' and 'addressee left without instructions'.

He also submitted that notice sent through dasti at Mumbai address of Respondent no.2, could also not be served as his father refused to receive notice, while notice sent by Hon'ble High Court at the same address on Respondent no.2 was received by his brother, as deposed by deponent Chandravadan Solanki, who is clerk in the office of Advocate of Applicant.

He further submitted that inspite of having knowledge of above SA. the Respondent no.2 has been avoiding service and hence, he be served through paper publication.

Application Ex.A/14 has been filed on affidavit. It appears that notice was sent to Respondent no.2 on 29.04.2024 through registered post at addresses of Mumbal and Ahmedabad, Which were not served due to 'addressee absent' and 'addressee left without instructions'.

It appears that insoite of having knowledge of above SA, Respondent no. 2 is avoiding service of notice. Application has been filed on affidavit. I my view, there appears to be sufficient ground to serve Respondent no.2 through publication. Hence, application Ex.A/14 is allowed in the interest of justice.

Notice be served on Respondent no.2 through publication in daily newspapers in english and in vernacular language having wide circulation in the locality, in wich Respondent no.2 ordinarily resides or carry his business at Mumbai and Ahmedabad

Steps through publication may be taken by Applicant.

Registry is directed to issue notice to serve Respondent no.2 accordingly

Put up on 19.06.2024 for hearing. Till then, order dated 22.04.2024, if any, shall continue.

ANIL KUMAR GUPTA PRESIDING OFFICER DRT-I, AHMEDABAD

## NIRBHAY COLOURS INDIA LIMITED (Formerly known as "Parth Industries Limited")

CIN: L91110GJ1993PLC017863

Regd. Off: No # 61/201, 2nd floor, Prerak Apartment, Near Wagh Bakri Tea Depot, Gujarat College Road, Ahmedabad - 380 006. Statement of Audited Results for the Quarter and Year Ended 31-03-2024

	Statement of Addited Results for the Quarter and real chided 32-03-2024 [ns. in cars								
Sr	Particulars		Quarter Ende	Year Ended					
No		31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023			
1	Total Income from Operation	181.30	6.21	18.95	191.84	28.00			
2	NetProfit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	162.85	5.76	0.92	164.44	4.38			
3	NetProfit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	162.85	5.76	0.92	164.44	4.38			
4	NetProfit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	120.20	5.76	(0.73)	121.80	2.73			
5	Total Comprehensive Income for the period [Compring Profit/(Less) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	120.20	5.76	(0.73)	121.80	2.73			
6	Equity Share Capital	335.00	335.00	335.00	335.00	335.00			
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.	10.98	5.2	-110.84	10.98	-110.84			
8	Earning Per Share (Face Value of ₹ 10/- each) (for continuing and discontinued operations)-								
	Basic	3.59	0.17	(0.02)	3.64	0.08			
	Diluted	3.59	0.17	(0.02)	3.64	0.08			

Notes; a. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed on a standalone basis filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Annual Financial Results are available on the websites i.e. www.bse.india.com and also on the company website: www.nirbhaycolours.com

b. The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors.

For, Nirbhay Colour India Limited Raghvendra Kulkarni (Managing Director) - DIN: 06970323

## ચૂંટણીના પરિણામ પછી ગઠબંધન સરકારને કારણે

અહા

# શું મ્યુચ્યુઅલ ફંડમાં પહેલાની માફક રોકાણકારોના પૈસા આવતા રહેશે?

મુંબઈઃ મંગળવારે શેરબજારમાં આવેલા ભારે ઘટાડાથી મ્યુચ્યુઅલ ફેંડ રોકાણકારોના મનમાં શંકા અને ડરની લાગણી જન્મી હતી. રિટેલ રોકાણકારો પણ તેમના રોકાણના મૂલ્યમાં ઘટાડો થવાથી ડરતા હતા. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં શેરબજારમાં આવેલી તેજીનો લાભ લેવા સ્થાનિક રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં વધુને વધુ રોકાણ કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી દ્વારા રોકાણ એપ્રિલ મહિનામાં પ્રથમ વખત રા.૨૦ હજાર કરોડના સ્તરને વટાવી ગયુ હતું.

આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે શું વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી છેલા ઘણા મહિનાઓથી મ્યુચ્યુઅલ ફંડ અને ડાયરેકટ માર્કેટમાં સ્થાનિક રોકાણકારોની જોરદાર લેવાલી પર હવે બ્રેક લાગશે?

શું મ્યુચ્યુઅલ કંડ હાઉસ અને રોકાણકારો તેમની રોકાણ વ્યુહરચના બદલશે?

વેલ્યુ રિસર્ચના સીઈઓ ધીરેન્દ્રકુમાર કહે છે કે, અર્થવ્યવસ્થા અને વ્યાપાર જે વિકાસના માર્ગ પર નીકળ્યા છે તે હવે બદલાશે નહી. શું કાંઈ જીએસટી સેમીકન્ડકટર, મેન્યફ્રેકચરીંગ, ઈન્ફ્રા, પીએસય રિફોર્મ્સ, કંપનીઓના નફામાં ફેરફાર કરી શકે છે?

આ હવે રિવર્સ થઈ શકે નહી હા, તેમાં થોડાં ફેરફાર થશે. પહેલા જેવી છુટ સાથે કામ કરી શકાશે નહી અને બજાર થોડા સમય માટે અસ્થિર રહી શકે છે.

પરંતુ એ પણ નિશ્ચિત છે કે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીના નાણાંનો પ્રવાહ ચાલુ રહેશે. એસઆઈપી રોકાણકારોએ આ ઘટાડાને તક તરીકે જોવી જોઈએ. રોકાણકારોએ તેમના રોકાણમાં વૈવીઘ્યીકરણ કરવું જોઈએ.

'દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે. બજારની આ પ્રતિક્રીયા ટુંકાગાળા માટે છે. આ ઘટાડામાં એસઆઈપી રોકાણકારોની સરેરાશ કિંમત ઘટશે, વધુ યુનિટસ ઉપલબ્ધ થશે. આ સમયે નવા રોકાણકારોએ જોઈએ તકને સમજીને રોકાણ કરવું જોઈએ.

ભિવિષ્ય માટે અંધાના ક્ષેપ્રિયા ક્ષિ. - ત્યોક લીવ અમ્યાદિત ત્યોક સ્ટેપ્ટર લોકિસ સરવાનું 500, ટાવર લે, પેરિન્ફામાં વિકારેસ પાર્ક, સેનાવિ આપ્ટ પાર્ગ, લોભર પોલ, મુંબઈ, અમ્યાદિત ત્યારે વિનાડ - 400013 દેશિકોલ 40888100, કેક્સ: 40888170

સોનાના દાગીનાની કરાજી અંગેની જાહેર સૂચના

જવાબદારી

એ મેં વા િક લ શું કે વા નિક્ષા કર્યા કરા કર્યા કરા કર્યા કર ાન ૮ લા છે. અને સંબંધિત શાળાએ પર ૧૦૦ આ 2004 ના રોજ ૧૧૦૦ વાદસ આવ્યા છતાં હજી સુધી બીકોપુત્ર કરવામાં આવા તથી. આ પણે એ પણ સ્ત્રિયાલી કોર્મિયા પ્રત્યાન વર્ષો પર કરવાની કાલા પ્રત્યા છે કે કે મહેલા માને મહિની સવાર માને હજી કે સ્ત્રિયાલી કોર્મિયા પાતાને દૂર કરવાની કાલા પ્રત્યે છે અને પૂર્વ સુધના વિના હરાજની તારીખ રદ કરવાની બાલાનાનો પ્રદેશક सुनिश्चित इरवुं करेल कर मेड कीन नेपार के पार करें के

નિયંત્રણ રાખવા 🕬

Place: Ahmedabad Date: 27.05.2024 MADHUVEER COM 18 NETWORK LIMITED Regd. Off: No # 812, Anand Mangal - III, Opp. Core House, Ambawadi, Ahmedabad - 380 006. Email : tohealpharmachem@gmail.com

CIN: L93000GJ1995PLC026244 Statement of Audited Standalone Results for the Quarter and Year Ended March 31, 2024 Standalon Consolidated Quarter Ended **Particulars** Year Ended Quarter Ended Year Ended 31.03.2024 31.12.2023 31.03.2023 31.03.2024 31.03.2023 31.03.2024 31.12.2023 31.03.2023 31.03.2024 31.03.2023 692.09 Total Income from Operation 403.74 4.53 3.62 423.36 13.32 671.26 5.32 4.04 NetProfit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) 385.41 2.39 0.06 368 1.35 314.15 2.25 -0.91296.08 1.5 NetProfit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items) 385.41 2.39 0.06 368 1,35 314.15 2.25 -0.91296.08 1.5 NetProfit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) 292.78 2.38 -0.72233.69 0.01 275.35 1.01 250.88 2.34 1.12 Total Comprehensive Income for the period [Compring Profit/(Loss) for the period (after tax) 292.78 2.38 275,35 2.34 0.01 1.01 250.88 -0.72233,69 1.12 and Other Comprehensive Income (after tax)] **Equity Share Capital** 948.07 948.07 948.07 948.07 948.07 948.07 948.07 948.07 948.07 948.07 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the 1317.58 1024.8 1317.58 -272.76 1945.06 -270.192195.94 -270.19-272.762195.94 Earning Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations) Basic 3.09 0.03 0 2.9 0.01 2.65 0.02 0.01 2.46 0.01 0.02 0.01 1.49 0.01 1.86 0.03 1.75 0.01 1.6

Notes: a. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed on a standalone basis filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format

of the Quarterly/ Annual Financial Results are available on the websites i.e. www.bse.india.com and also on the company website: www.mcom18.com The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors.

Place: Ahmedabad Date: 28.05.2024

Place: Ahmedabad Date: 30.05.2024

Divya Rathi - Company Secretary - PAN: CCPPR7114F

For, MADHUVEER COM 18 NETWORK LIMITED

JYOT INTERNATIONAL MARKETING LIMITED Registred Office: Room No # 1, 1, Pandurang Society, Judges Bungalow Road, Bodakdev, Ahmedabad. Gujarat - 380 054 CIN: L65910GJ1989PLC012064 Statement of Audited Standalone Results for the Quarter and Year Ended March 31, 2024 Standalone Consolidated **Quarter Ended** Year Ended Quarter Ended No 31.03.2024 31.12.2023 31.03.2023 31.03.2024 31.03.2023 31.03.2024 31.12.2023 31.03.2023 31.03.2024 31.03.2023 117.83 114,43 1827.72 147.69 114.43 497.3 405.81 148.52 117.87 500.25 Total Income from Operation NetProfit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) 16.88 1.78 10.28 33,55 12.07 -142.860.82 -2.56126,56 1407.45 NetProfit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items) 16.88 1.78 10.28 33.5 12.07 -142.860.82 -2.56126,56 1407.45 NetProfit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) 12.65 1.33 25,13 -147.090.37 4.82 -148.821266.07 7.83 8.92 1266,07 12.65 Total Comprehensive Income for the period [Compriing Profit/(Loss) for the period (after tax) 1.33 7.83 25,13 8.92 -147.090.37 -4.82-148.82and Other Comprehensive Income (after tax)) **Equity Share Capital** 312.19 312.19 312.19 312.19 312.19 312.19 312.19 312.19 312.19 312.19 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the 104.33 79.19 79.19 2288.45 228.08 2437.27 2288.45 2437.27 103 79.19 Earning Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations)-0.04 0.25 0.25 0.29 40.55 Basic 0.41 -4.71 0.01 -0.154.77 0.04 40.55 Diluted 0.41 0.25 0.25 0.294.71 0.01 -0.154.77

The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed on a standalone basis filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format Notes: a.

of the Quarterly! Annual Financial Results are available on the websites i.e. www.bse.india.com and also on the company website: www.jyotinternationalmarketing.co.in The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors.

By Order of the Board of Directors For, JYOT INTERNATIONAL MARKETING LIMITED

Jayesh Narendrakumar Shah - Managing Director - DIN: 03548968



















